https://archive.org/details/bk1060/page/n0/mode/1up

All Items on https://archive.org/details/realpatidar
realpatidar.com
Full Library on https://realpatidar.com/library

નખત્રાણા પૂર્વવિભાગી તા ૨૮

KJ-199

શ્રી. પૂર્વવિભાગ નખત્રાણામાં
ભરાયેલ કારોબારી સભા-

સભાના પ્રમુખ-

પ્રમુખ. શ્રી રામજી ભાઈ જેઠાભાઈ

સનાતન ધર્મકી જય- ઉમિયા માતકી જય-

સ્તુતિ- સનાતની કન્યા ની [illegible]
નખત્રાણા. મિત્ર મંડળ-

કાનજી ભાઈ આણંદજી- આજની સભાનું પ્રમુખ સ્થાન શ્રી. રામજી ભાઈ જેઠાભાઈ એ સ્વીકારવા ની દરખાસ્ત-

શ્રી. નથુભાઈ મંત્રી. કાનજી ભાઈની દરખાસ્તને અનુમોદન.

શ્રી. રામજીભાઈ જેઠા- નથુભાઈ ને બોલવાની દરખાસ્ત.

શ્રી. નથુભાઈ }
પ્રમુખ. [illegible] }

આજે અમારે આંગણે આપ સર્વે ભાઈઓ એ [illegible] દિલથી અમારો [illegible] છે તે બાબતમાં અમારો ઉપકાર માનું છું. આપણી આજની પહેલી સ્થાન [illegible] ના પ્રમુખ શ્રી. સભા ને એની દરખાસ્ત રજુ કરું છું.

શ્રી. રતનશી ભાઈ- મે. પ્રમુખ સાહેબ-

આપણી આજની સભા બોલાવવામાં આવેલ છે તે મારી સમજ મુજબ એ બોલાવવાની આપણો વિચાર હતો [illegible] પછી [illegible] ને લીધે આજે કાર્યવાહક [illegible] સભા [illegible] સભાનું સ્વરૂપ [illegible] કરવામાં આવી છે તે બદલ મને ઘણો [illegible] આનંદ થાય છે. આપણી કાળીમાં આવેલ જાગૃતી એ [illegible] ખાત્રી છે કે આપણી કાળી હવે ટુંક સમયમાં જ [illegible] ધર્મને છોડી દેશે. આપણી આજની જાગૃતી [illegible] પુરી [illegible] સમજુ [illegible] સમજુ [illegible] વિનંતી છે. [illegible] મારા વ્હાલા [illegible] ને [illegible] કે આપણી કાળી [illegible] કરો. આપ પુરી [illegible] તો [illegible] મારા [illegible] સનાતની ભાઈઓ [illegible] ની એટલી વિનંતી છે કે આપણું કાર્ય [illegible] ની જું છે. [illegible] સાથે [illegible] સિદ્ધાંતો [illegible] સમજાવવાનો [illegible] પ્રયાસ કરે જ છે. આપણી કાળી માં [illegible] ઘરસાળો [illegible] ને એ [illegible] કરવા માટે આપણે આપણાં [illegible] અપાવવા [illegible] રહેવું

realpatidar.com

https://archive.org/details/bk1060/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1, 10.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v7.py

https://archive.org/details/bk1060/page/n2/mode/1up
-Nakhtrana Sanatani Meeting (1060)
Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.20 16:58:19 +05'30'
realpatidar.com

KJ-199

શ્રી. પુર્વ વિભાગના નખત્રાણામાં
ભરાયેલ કારોબારી સભા-

સભાના પ્રમુખ-
પ્રમુખ. શ્રી રામજી ભાઈ જેઠાભાઈ

સનાતન ધર્મ કી જય- ઉમીયા માત કી જય-
સ્તુતિ- સનાતની ઝંડા ની ધ્વની.
નારાણજી. શિવ મંડળ-

કાનજી ભાઈ આહિરુ- આજની સભાનું પ્રમુખ સ્થાન શ્રી. રામજી ભાઈ જેઠાભાઈ ને સ્વીકારવા ની દરખાસ્ત-

શ્રી. નથુભાઈ મંત્રી. કાનજી ભાઈ ની દરખાસ્ત ને અનુમોદન.

શ્રી. રામજીભાઈ જેઠા- નથુભાઈ ને બોલવાની દરખાસ્ત.

શ્રી. નથુભાઈ
પ્રમુખ-વતી.

આજે અમારે આંગણે આપ સર્વે ભાઈઓ એ પધારી અમારો આ આમંત્રણ સ્વીકારી છે તે બદલ અમારો ઉપકાર માનું છું અને આપણી આજની પડેલી સભાના સભાપતિ ના પ્રમુખ શ્રી. સભા ને એટલી દરખાસ્ત રજુ કરું છું.

શ્રી. રતનશી ભાઈ- પ્ર. પ્રમુખ સાહેબ-
આપણી આજની સભા બોલાવવામાં આવેલ છે તે મારી સમજ મુજબ એ છે કે આપણે વિચાર કરીને પરંતુ આપણી ભાવનાઓ લીધી આજે કાર્યવાહક સમિતિ ની દર સભા માટે સભાનું સ્વરૂપ ધારણ કરવા માગી છે તે બદલ અમે આપનો શ્રદ્ધા આનંદ થાય છે. આપણી કામમાં આવેલ નાગલીઓ એ અમે જાણીએ છીએ કે આપણી કામની દુઃખે કરી સમય માં જ સનાતન ના ધર્મ ને છોડી દેશે. આપણી આજની નાગલી પા. અત્યાર સુધી ભોગવનારા એટી પાણી સમાજ ગયા. હવે અમે સમાજ જેવી ... ભાઈઓ ... વિનંતી છે.
એટલે. મારા વ્હાલા સ્વાભાવિક જનોને ... કે આપણા કાર્ય સારા પૈસાઓ નું ઉપયોગ- અત્યાર સુધી ... ની સંસ્થામાં અને મારા પ્રમાણે સનાતની ભાઈઓ ની એટલી વિનંતી છે કે આપણું કાર્ય શાંતી નું છે. એમ આ પ્રમાણે આની સાથે સિદ્ધાંતો ... માટે સમજાવવાની ... જ પ્રયાસ કરે જ છે. આપણી કામની ... પરસ્પર સારાં છે એ કે એ રસો બાબુર કરવા માટે આપું છું આપણાં રક્ત ... આપવા માટે ...

https://archive.org/details/bk1060/page/n3/mode/1up

realpatidar.com

કુંપની એ ગંગા છે તો તે ગંગા સ્વરૂપ કુંપની માંથી અંધશ્રદ્ધા
ગુરૂ [illegible] ને દુર કરવા છે. આજની આપણી સભા જાહેર
સભા નથી કે જેમાં આવેલ નથી. પરંતુ કારોબારી મીટીંગ છે
એટલે આપણે હવે ટુંક વિવેચન કરી. આ સભા કારણ જરા જરૂર પડી.
આ ચર્ચાના લેખાની ખાસ જરૂર છે. મારા ભાઈઓ હવેથી ખાસ ધ્યા
ન રાખજો કે આપણા ગોરના પાપે પાપે પેદા થયેલ પૈસાના ધર્મા
દા કુંપની ફંડનો જે ઉપયોગ આપ જુઓ છો. વહીવટ કરનારાઓ
વાપરે તે કરવા આપ જાણો છો. આપણે આપણા સનાતની
ભાઈઓને કહેવાનું દરેક ગામમાં પોતાના યુવક મંડળો સ્થાપે છે.
એવી. મારી આપ સર્વે ગામના ભાઈઓને વિનંતી છે, આગેવાનો
મંડળોના કાર્ય ક્રમ આપણા પછી ગોઠવશું. માટે આગેવાન આ
પણો ધર્મવાદને [illegible] ગયેલ સાટો [illegible] નાખવા મારા સમાજ કા
ની ભાઈઓ તૈયાર રહેશો એવી વિનંતી છે. આપણે આપણા
ધર્મ સાચવવા મરણીયા બનીને ઉભા રહેશું તો ગમે તેટલાં સંકટો
વેઠશો તો પણ લ્હાવો છે. હવે બીજા ભાઈઓ બોલવાના હોવાથી હું
મારૂં વિવેચન પૂર્ણ કરવા માગું છું કારણ આજે આપણને ઘણાં અ
ગત્યનાં કાર્યો કરવાનાં છે. અને મારા પરદેશ વસતા ભાઈઓ પાસે
સંભળાવવા કરવામાં આવે છે. કે મારા કહ્યા પ્રમાણે આપણા
યુવક ભાઈઓ [illegible] પંથને [illegible] પોતાનાં [illegible]
વડીલો ના દબાણથી કરેલી પ્રતિજ્ઞાઓ પણ પાળી શકવાના નથી.
તો ભાઈઓને ખાસ વિનંતી કરૂં છું કે જાગૃત રહેજો.
વાયુ. ભાઈ - મંત્રી.

આપણો બાપ દાદાના વખતથી ધર્મના રક્ષણ માટે વારંવાર બોલતી
એટલી એ પરંતુ આજે આપણાને ધર્મ સાચવવામાં કરવી કે
સાંટીઓ [illegible] પડેલ [illegible] પડશે. તે [illegible] ભાઈએ સમજ
વું જોવે હું કેટો આપું છું. આપણી કાળીપરજના પૈસાનો ઉપયો
ગ આજે ભુજની બજારોમાં કેવો થાય છે તે આપ [illegible]

realpatidar.com

વિશ્રામ ભાઈ પાંચા.

મને આજની સભામાં બોલવાની દરખાસ્ત મુકવામાં આ
વેલ છે તો મારી બુદ્ધિ અનુસાર બોલી જઈશ. આજે આપણી
કંપની માં ભાગલા પડેલી છે. તે જોઈને મને બહુજ દુઃખ થાય છે.
માટે આપણી આજની ભાગલા જેવી અવસ્થા છે તેવીજ રહ
શે તો [illegible] રાખી શું એવી મારી. આપ ભાઈઓ પાસે માફી
માગું છું. માટે આપણે હવે ખાસ સમજવું જોઈએ કે

૨ KJ-200

પરણાવવા ધર્મ અર્થે ... ધર્મ છે માટે એ ધર્મને આપણે જરૂર છોડી દેવો જોઈએ. આપણી જ્ઞાતિ માં ઘણા ભાઈઓએ આ પંથ ને છોડી દીધેલ છે છતાં પણ હજુ જે એ પંથના અંધ શ્રદ્ધાળુ માત્ર મારા જ્ઞાતિ ભાઈઓને, મારે કહેવાનું આટલું જ છે કે: આપણે આપણા જ્ઞાતિ ફંડના પૈસાનો દુરુપયોગ કરવો નહિ જ આપણે. આપણો પૈસો સંસ્થાઓને [illegible] શ્રી પટેલ [illegible] કેળવણી અર્થે કરો નહિ. ~~માટે~~ હવે મારી પાછળ બોલનાર ભાઈઓને બોલવા વારો આપું.

પરબત-

આપણી આગળની સભામાં આપણા આગેવાન ઉપદેશકો હું ભાઈ શ્રી પધારેલ છે તેમને હું આનંદ માનું છું. શ્રી રતનશી ભાઈએ જે વિવેચન કરેલ છે તે ખરેખર મારા પણ જોવામાં ઘણાં ગામો માં આવે છે. આપણી જ્ઞાતિના કેટલાક યુવકો પરદેશમાં આ પાખંડી પંથનો ત્યાગ કરવાની [illegible] અહીં કચ્છમાં આવી હજુ પણ [illegible] છોડી દેવો માટે તેવા ભાઈઓને સમજ રહેલા ભાઈ [illegible]

શ્રી [illegible] ભાઈ [illegible] રતનશી આ-

આવા જનરલ સભાઓમાં જે કદી પણ વિવેચન કરેલ નથી. છતાં પણ આપ સર્વે ભાઈઓએ મારા પર બોલવાની ફરજ પાડેલ છે. હું પણ મારા અનુભવો [illegible] લાવીશ. આ મારા ગામ રસલીઆના [illegible] આપણી પાખંડી પીરાણા પંથના [illegible] શ્રી [illegible] પરંતુ ધર્મ [illegible] પીરાણા પંથ [illegible] આપણે ને પાંડવોની માફક આપણો [illegible] ધર્મ [illegible] ઘણાં સંકટો [illegible] પડશે. પરંતુ [illegible] આપણી [illegible] આપણો [illegible] ધર્મ માં [illegible] આપણી જ્ઞાતિ ઉપર પડશે [illegible] આપણા [illegible] સંચાલન પીરાણા પંથ [illegible] આપણા [illegible] પંથ [illegible] હજુ પણ [illegible] જ્ઞાતિ [illegible] માલીક [illegible] અમારા [illegible] ઘણા જ્ઞાતિ ભાઈઓ [illegible]

realpatidar.com

https://archive.org/details/bk1060/page/n5/mode/1up

કાયમ કરી છે કે અમો હવેથી પાટીદાર પંથના સનાતનીઓ
છીએ. હજી પણ અહીં આવો. આપણી સનાતનધર્મ સભામાં
નામ દાખલ કરો. ઇમામને ભંડારી ની વાતો કરી રહ્યા છે આજે
આપણા પૈસા વરસો વરસ આપ ખુશીથી સત્ય મળાવે છે ત્યાં
તેઓના હાથમાં છે. આપણો આપણો ફાળો ફંડનો પૈસા
ખાસ કરતા કરી રહી એ જ્યારે તેઓ પાટીદાર પુત્રની
માટે આપણી ફંડની રકમ બીજે ઉપયોગ કરે છે.

શ્રી ઠક્કર.

ભાઇઓ-બહેનો

આજે અહીં જાહેર સભા કરવા સૌથી મારી ઇચ્છા
હતી. છતાં પણ અહીં આવતાં આ કાર્ય જોઇને
મહારાજ આવતાં મારું મન પહેલાં ... લાગી
ગયા તેઓ એક હતું કે આવા ભોળા આપણા ભાઇ ...
પરંતુ આવા ભોળા ... પરંતુ તેઓ આપણા છે આપણા
આપણા તેઓના છીએ. છતાં પણ તેઓ જે એમની આ ...
હોય કે ... પોતે પૈસા છે. તો એ ... ના ...
... છે ... તેઓના પૈસા આપણા ... આ
પણ આપણે સમાજની માટે આજે પરદેશ. ...
... આવી એમાં એ આપણા ... લોકો ...
ભાઇઓ ... આપણા ...

સ્વાગત

મને તો વિચાર આવે છે કે કચ્છમાં ... ફાળો ...
... આવેલા છે. અને તે ફાળો એ ... ધર્મના
પૈસા ... આપણા ફાળામાં ... ધર્માદાનો
... આવે છે. પરંતુ આ ફાળાનું ... આજ
... આજ સુધી ... આવતું નથી. ...
... એમ ... હું ... જોઉં છું ...
... આપણાં ... હું ...

realpatidar.com

https://archive.org/details/bk1060/page/n6/mode/1up

KJ-201

realpatidar.com

ભાઈ [illegible] [illegible]
રૂપરાજ ભીમજી પોકાર

મેં કદી પણ સભામાં ભાષણ કરેલ નથી તેથી હું મારા વિચારો ટુંકમાં જ જણાવીશ. આપણી જ્ઞાતીમાં ઐક્ય પણાની ખાસ જરૂર છે. તો ભાઈઓ જો બની શકે ત્યાં સુધી [illegible] કેળવણી [illegible] છે. અને કેળવણી [illegible] [illegible] નથી. કેળવણી [illegible]. અને આપણે પોતાનાઓ [illegible] જ્ઞાતીની ખાસ જરૂર છે અને તે ક્યારે બની શકશે કે જ્યારે આપણું સંગઠન [illegible] બનશે [illegible] [illegible] સંગઠન [illegible].

ધારશીભાઈ ભીમજી [illegible]

મેં આજે આગાઉ ક્યારે પણ સભામાં ભાષણ કરેલ નથી. જેથી હું મારા [illegible] વિચાર [illegible] તેમાં કંઈ પણ ભૂલચુક હોય તો દરગુજર કરશો.

આપણી જ્ઞાતીમાં [illegible] જે કુરીવાજો [illegible] છે તે [illegible] યુવક વર્ગને [illegible] છે. તો મારા યુવાન ભાઈઓને મારી ખાસ વિનંતી છે કે આપણે [illegible] આપણી જ્ઞાતી [illegible] મારા વડીલોને પણ ભલામણ કરું છું કે [illegible] તેઓ જ્ઞાતી [illegible] તેઓ [illegible] ભલામણ કરું છું
[illegible]
[illegible] ભાઈ [illegible]

મારા યુવક ભાઈઓને જણાવું છું કે [illegible]
[illegible]
[illegible]

realpatidar.com

હુંસરાજભાઈ દાના.

realpatidar.com

આજે કેટલાંક વરસોથી આપણા સનાતન ધર્મ માટે કેટલી મહેનત ઉઠાવી રહ્યા છે તે આપણે સર્વે જાણીએ છીએ. તો આપણે આપણા સુધારક ભાઈઓને સાથ આપવાની આપણી ફરજ છે. અને આપણાજ [illegible] આપણા સુધારક ભાઈઓ પોતાના દરેક કાર્ય પર [illegible] આપણા સનાતન ધર્મ માટે ઝુઝી રહ્યા છે ને આપણે આપણા ત્યાગી ભાઈઓ [illegible] શકીએ છીએ. છતાં પણ આપણે આપણી ફરજ ભુલી જતા નહિ. મનુષ્યની ફરજ એ જ છે કે આપણે આપણા [illegible] કરવા જોઈએ [illegible] ભાઈઓ [illegible] એવું કંઈ નહિ. [illegible] આપણે આપણા ધર્મની [illegible] આપણા [illegible] દેશમાં આપણા [illegible] રહ્યા છીએ તેમને [illegible] ને આપણે આપણા ધર્મ [illegible] માટે પણ આપણાં ઘર [illegible] ધર્મ માટે ઝુઝવું જોઈએ. આપણે [illegible] આપણા [illegible] સમજવું જોઈએ. આપણા સનાતન સંગઠન [illegible] આપણે આપણા ધર્મ માટે [illegible] આપણા [illegible] કરી [illegible] ભાઈઓ [illegible] આપણી છે. અને આપણે આપણા કેટલા સનાતની સંગઠન માટે [illegible] દૂર રહેવું જોઈએ. [illegible] ના [illegible] છે. અને હવે આપણે [illegible] તો [illegible] પણ [illegible] ધર્મ સંભાળવો જોઈએ. અને આપણા ધર્મ [illegible] પ્રચાર [illegible] જોઈએ.

realpatidar.com

KJ-202

realpatidar.com

[illegible] આ ધર્મ માં [illegible] ગુરુઓ [illegible] આ ઉદ્દેશોની [illegible]
[illegible] છે કે જો ઉદ્દેશો અમલમાં મૂકે તો ધર્મ ઉપર આવેલા
સંકટ માંથી બચાવ થાય એ માટે એમ મને લાગ્યું છે. અને એવા
[illegible] ભાઈઓ આ ધર્મ [illegible]
[illegible] સુધી. તમારા [illegible] પ્રત્યેક [illegible]
એમ ઇચ્છું છું. તમારો આ હીંમત પ્રજ્વલિત રહેશે. અને તમારી
આપણી બુદ્ધિ જાગૃતી એ સાથે પ્રજ્વલિત રહેજો એ સ્વાભાવિક છે.
મને આ જ એક અનુભવ થયો છે કે તમારા યુવક [illegible]
ભાઈઓ [illegible] કરવા કહ્યું કે મને તમારા સનાતન ધર્મ [illegible]
[illegible]
[illegible] સ્વીકાર કરે [illegible] કહ્યું [illegible]
તમારી [illegible] સનાતન ધર્મનો સ્વીકાર

પ્રેમનું [illegible]

આજે પહેલાં આપણા [illegible] ભાઈઓ ધર્મ [illegible]
[illegible]
[illegible] આપણા [illegible] ભાઈ [illegible]
[illegible] છું કે આપણે આપણા [illegible] ભાઈ [illegible]
[illegible]
[illegible] છું આપણે યુવકો [illegible]
આપણે આપણા સનાતન ધર્મ [illegible]
[illegible] ભાઈ [illegible]
[illegible] આપણે [illegible]
[illegible] યુવકો આપણે [illegible]

realpatidar.com

[illegible]
[illegible] ભાઈ [illegible]
[illegible] ધર્મની [illegible] આપણા [illegible]
[illegible] આપણા [illegible]
[illegible] આપણા [illegible]
[illegible] ભાઈઓની [illegible] આપણા [illegible]
[illegible]

https://archive.org/details/bk1060/page/n9/mode/1up

realpatidar.com

પણ સનાતન ધર્મનાં ઝંડા આપણી સ્થાની પર ફરકાવીએ
માટે બહેનોને ખાસ વિનંતી કરું છું કે તમો પણ ધર્મ [illegible]
ઉઠાવવાની તમારા પુત્રો અને ભાઈઓ પર ફરજ પાડો.
અને આપણા ધર્મનો [illegible] કે આપણી સ્થાની
પર પડે તેવા [illegible] અને શુદ્ધ રીતે ફરકાવવી. [illegible]
[illegible] આપો. વિશેષ આપો અને ધર્મની [illegible] ભાઈઓ
બહેનો [illegible] આવે તેવી [illegible]
આપણાને [illegible] ખાસ જરૂર છે. [illegible]
[illegible] આપણું [illegible] હોય તો આપણે [illegible]
[illegible] આપણે [illegible]. [illegible] ભાઈ [illegible]
[illegible]
બહેનો [illegible] એવી મારી [illegible] ભાઈઓ [illegible]
[illegible]
હવે રજા આપશો
[illegible]
રૂ. [illegible]

આપણે આપણા સનાતન ધર્મ [illegible]
એ માટે આપણે આપણું [illegible] ધર્મ [illegible]
[illegible] છે કે [illegible] ધર્મ [illegible]. [illegible]
[illegible] ભાઈઓને ખાસ વિનંતી છે કે આપણે આપ-
ણો [illegible] ધર્મ [illegible] આવ્યો છે [illegible]
તે ધર્મને [illegible] માટે હવે આપણને [illegible]
[illegible] આપણે આપણા [illegible]
ભાઈઓ એ તે માટે [illegible] એ. આપણા [illegible]
સનાતન ધર્મનો સૂર્ય [illegible] હવે એ
[illegible] જરૂર [illegible]. [illegible]
[illegible] અને આપણી જ્ઞાતિના [illegible]
[illegible] ભાઈઓ. આપણા સનાતન સમાજના [illegible]
[illegible] માટે તેઓના [illegible]
સનાતન ધર્મ [illegible]
[illegible] આપણે સનાતની

realpatidar.com

https://archive.org/details/bk1060/page/n10/mode/1up

KJ-203

realpatidar.com

રતનશીભાઈ ખીમજી - પ્રમુખ.

હવે સમય ઘણો થયેલ છે. અને હવે પછી કોઈ બીજી મીટીંગ ~~ભરવાની~~ બોલાવવાની હોઈ. હવે આપણે સભા કાર્ય જરૂરાજરૂર પણ સમેટી લેવું જોઈએ. આજની સભામાં અમોને ખાત્રી થયેલ છે કે ઘણું સારા એ મુદ્દાઓ પહેરી છે. તેમાં કોઈ બીજી હશે કારણ કે અમારા માં સારા કરી જેવા મન આવવી હશે ત્યાં જ આદર તેર થયેલ છે. મારા યુવક ભાઈઓને ખાસ વિનંતી કરું છું કે આપણે આપણા સનાતન ધર્મનો પ્રચાર કરવા ની ખાસ જરૂર છે. હવે આપણી સભા પુરી કરવાનો સમય થઈ ગયેલ છે [illegible] તેની સભા [illegible] સભામાં પ્રમુખ કાર્ય કરવામાં [illegible]

શેઠ. જેરામભાઈ.

આજનું શેઠ. પ્રમુખ સાહેબ [illegible] મંત્રી મહાશય [illegible] જરૂર કોઈ પણ [illegible] કરવું પડે એમ જણાય છે. [illegible] આપણું [illegible]

શેઠ. નથુભાઈ. મંત્રી

મેં આજ [illegible] મારી [illegible] રહુ [illegible] પણ [illegible] હું [illegible] આટલા [illegible] હજુ પણ [illegible] છું કે [illegible] સેવા કરવા ~~[illegible]~~ નું ભાગ્ય છું.

સમાપ્ત. ૨૩-૧૦ રાત્રે.

પ્રમુખશ્રી

સહી- ડૉ. [illegible]

realpatidar.com

https://archive.org/details/bk1060/page/n11/mode/1up

KJ-204

તા. ૨ - [illegible]

કારોબારી મીટીંગની.
નોંધ.

realpatidar.com

— [illegible]

૧ કુંડની રકમ [illegible]

[illegible]

ઠરાવ- [illegible]

[illegible]

જવાબ- [illegible]

[illegible]

ઠરાવ- [illegible]

[illegible]

જવાબ- [illegible]

— [illegible]

જવાબ- [illegible]

[illegible]

૨ [illegible]

૩ [illegible]

૪ [illegible]

realpatidar.com

૫ - દરેક ગામના [illegible]

૬ આપણું [illegible]

૭ દરેક ગામના [illegible]

https://archive.org/details/bk1060/page/n12/mode/1up

realpatidar.com

આપણે આપણા દિલમાં જે સારમાં પૈસાની પણ જરૂર છે
તેને માટે આપણે ફંડ એકઠું ~~કરવું~~
કારણ કે ગામના રાજ્યની ભાઈઓ એ કરેલી-
૯ ઠરાવ [illegible] આપણા [illegible] ભાઈઓનું પોષણ
કરવામાં આવે છે તેઓના પોષણ કાર્ય જરૂર [illegible]
ખર્ચ પડે છે. તો તેને આપણે મદદ આપવાની
આપણી ફરજ છે, તો તેનું શું કરવું?
સનાતન ધર્મ ને [illegible] મહત્ત્વ [illegible]
માનવાની આવશ્યક છે

પ્રમુખશ્રી · શ્રી · રતનશી ખીમજી - નખત્રાણા · રતનશી · [illegible]

ઉપ પ્રમુખ - ડૉ. જી. બી. પટેલ ઉખેડી. ઇ. પો. ના.

મંત્રી · શ્રી. નથુભાઈ ભાણજી - [illegible]

કારોબારીના સભ્યો.

પટેલ પરબતભાઈ લધુ - નખત્રાણા સાંખરા ભગત લધુ દાંધોતાનાં
" શિવગણભાઈ કાનજી - [illegible]
"

શિવગણ [illegible] કાનજી [illegible]
[illegible] ગામ
[illegible]
[illegible] દેવરાજ કાનજી [illegible]
દાધોતાના ગા. દેવરાજ
[illegible]
[illegible]
[illegible]
~~રામજી [illegible] દાધોતાના ગામના~~
[illegible]
[illegible]

~~Purbat~~ Nathoo Patel
Vithon

~~[illegible]~~
~~[illegible]~~
~~[illegible]~~
ઉખેડા
~~[illegible]~~
ગામ નખત્રાણા

realpatidar.com